

કીટકશાસ્ત્ર વિભાગ, બં. અ. કૃષિ મહાવિદ્યાલય, આ.કૃ.યુ., આણંદ તથા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, આ.કૃ.યુ.,  
દેવાતજના સંયુક્ત ઉપક્રમે “કૃષિ પાકોમાં સંકલિત જીવાત વ્યવસ્થાપન” વિષય પર ચાર દિવસીય  
તાલીમ કાર્યક્રમ યોજાયો

કીટકશાસ્ત્ર વિભાગ, બં. અ. કૃષિ મહાવિદ્યાલય, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ તથા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, આણંદ કૃષિ યુનિવર્સિટી, દેવાતજના સંયુક્ત ઉપક્રમે “કૃષિ પાકોમાં સંકલિત જીવાત વ્યવસ્થાપન” વિષય પર તા.૨૨.૦૨.૨૦૨૨ થી ૨૫.૦૨.૨૦૨૨ દરમિયાન ચાર દિવસીય તાલીમ કાર્યક્રમ યોજાયો, જેમાં આણંદ જિલ્લાના કુલ ૩૭ ખેડૂતો હાજર રહ્યા હતા. કાર્યક્રમના પ્રથમ દિવસે ઉદ્ઘાટન સમારંભ યોજવામાં આવેલ હતો. જેમાં કીટકશાસ્ત્ર વિભાગ, બં. અ. કૃષિ મહાવિદ્યાલય, આ.કૃ.યુ., આણંદના પ્રાધ્યાપક અને વિભાગીય વડા ડૉ. ડી. બી સિસોદીયા તથા મદદનીશ પ્રાધ્યાપક ડૉ. એચ. સી પટેલ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમની શરૂઆતમાં કેવિકે, દેવાતજના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડૉ. એ. સી. વૈદ્ય દ્વારા સર્વે ખેડૂતોનું સ્વાગત કર્યા બાદ પ્રસંગોચિત ઉદબોધન કરવામાં આવ્યું હતું. વધુમાં તેઓએ જીવાત વ્યવસ્થાપન અંગેની વિસ્તરણ શિક્ષણ પ્રવૃત્તિઓ વિશે ચર્ચા કરી હતી. ડૉ. ડી. બી સિસોદીયાએ કીટકશાસ્ત્ર વિભાગની યોજનાકીય તેમજ વિવિધ પ્રવૃત્તિઓની માહિતી આપે લ. ત્યારબાદ ડૉ. એચ. સી પટેલ દ્વારા યુનિવર્સિટીની શૈક્ષણિક, સંશોધન તેમજ વિસ્તરણને લગતી વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. ડૉ. આર. એમ. પટેલ, વૈજ્ઞાનિક (પાક સંરક્ષણ), કેવિકે, દેવાતજ દ્વારા ઉપસ્થિત સર્વેનો આભાર વ્યક્ત કરી ઉદ્ઘાટન કાર્યક્રમની પૂર્ણાહૂતી કરવામાં આવી હતી.

આ તાંત્રિક કાર્યક્રમ માં આણંદ કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકશ્રીઓ દ્વારા તાલીમને લગતી સંપૂર્ણ માહિતી આપવામાં આવી. જેમાં ધાન્ય, કઠોળ, શાકભાજી, તેલીબીયા તથા ઘાસચારા પાકોમાં સંકલિત જીવાત વ્યવસ્થાપન, જીવાત વ્યવસ્થાપનના ઘટકો અને મોજણીની પ્રાયોગિક માહિતી, સંગ્રહેલા અનાજની જીવાતોનું સંકલિત વ્યવસ્થાપન, ઉંદરોની જાતો, નુકશાન અને નિયંત્રણ વગેરે વિષયો પર વિસ્તૃતમાં ચર્ચા કરવામાં આવી હતી.

કાર્યક્રમના છેલ્લા દિવસે ખેડૂતોને આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ ખાતે મધમાખી ઉછેર કેન્દ્ર, સરદાર પટેલ એજ્યુકેશનલ મ્યુઝિયમ, નિંદણ નિયંત્રણ યોજના, શાકભાજી સંશોધન કેન્દ્ર તેમજ ઘાસચારા સંશોધન યોજનાની મુલાકાત કરાવવામાં આવેલ હતી. તાલીમાર્થીઓએ ફીડબેકમાં જણાવ્યું હતું કે આ તાલીમ તેમને ખુબજ ઉપયોગી નીવડશે. તથા વિવિધ કીટકોની જુદીજુદી અવસ્થાઓ નું પ્રત્યક્ષ નિદર્શન અને તેઓના નિયંત્રણ માટે ફક્ત રાસાયણિક દવાઓજ ન વાપરતા અન્ય સંકલિત જીવાત નિયંત્રણ માટેના પગલાં કઈ રીતે લેવાં તે વિશે ઊંડાણપૂર્વક માહિતી મળી છે. અંતમાં પ્રમાણપત્ર વિતરણ કર્યા બાદ તાલીમનું સમાપન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આભાર દર્શન મીનાક્ષીબેન લુણાગરિયા દ્વારા કરવામાં આવેલ હતું.

## તાલીમ કાર્યક્રમની ઝાંખીઓ

